



**N. K.
Industries Ltd.**

Date: 11/11/ 2023

To, National Stock Exchange of India Limited Exchange Plaza, Plot C-1, 'G' Block, ISB Centre, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai-400 051.	To, BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001.
Company Code No. NKIND	Company Code No. 519494

Dear Sir/Madam,

Sub: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to the subject referred Regulation, we would like to inform you that Extract of Unaudited Financial Results for the quarter ended 30th September, 2023 as approved in the Board meeting dated 9th November, 2023 has been published in the Financial Express Newspaper (English) & Financial Express Newspaper (Gujarati) on 10th September, 2023.

A copy of the said newspaper advertisement is enclosed for your reference and record.

You are requested to take the same on records.

Thanking You.

**Yours faithfully,
N K INDUSTRIES LIMITED**

NIMISH KESHAVLAL PATEL
Chairman & Managing Director
DIN: 00240621

Registered Office: 7th Floor,
Popular House, Ashram Road
(N.G.)
Ahmedabad - 380 009.
India

Ph.: +91-79-6630 9999
Fax: 91-79-26589214

E-Mail :nkil@nkproteins.com

Plant: 745, Kadi-Thor road
Kadi - 382 715 Dist. Mehsana

Tele : (02764) 242613, 263884
Fax: (02764) 263667
Email: nkilkadi@yahoo.co.in

CIN NO. : L91110GJ1987PLC009905

ન્યુઝ ટ્રેક

દિવસિય બેંક પ્રોપર્ટી ફેર-૨૦૨૩

દિવસિય બેંક સાયન્સ સિટી બ્રાન્ચ ખાતે ૮ અને ૯ નવેમ્બરના રોજ બે દિવસિય પ્રોપર્ટી મેળાનું આયોજન કર્યું હતું. લોકો તરફથી આ પ્રોપર્ટી મેળાને અદભુત પ્રતિસાદ મળ્યો હતો. આ સેગમેન્ટમાં રહેણાંક મિલકતો, કોમર્શિયલ, મિલકતો, ઔદ્યોગિક મિલકતો અને વોટ મળી કુલ ૧૫૦ મિલકતો ડિસ્પોઝિટ માટે મુકવામાં આવી હતી. નવેમ્બર અને ડિસેમ્બર, ૨૦૨૩ ના આગામી દિવસોમાં મિલકતો હરાજી માટે મુકવામાં આવશે.

N. K. Industries Limited

Registered Office: 7th Floor, Popular House, Ashram Road Ahmedabad - 380 009
Work: 745, Kadi-Ther road, Kadi - 382 715 Dist. - Mahesana (North Gujarat)
E-mail: nkil@nkinstruments.com Web: www.nkinstruments.com
CIN: L91110G19877PLC009905, Ph.: +91-79-4630-9999

Extracts of unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended on 30th September, 2023
(Rs. In lacs)

Particulars	Standalone			Consolidated		
	Quarter ended 30/09/2023	Quarter ended 30/09/2022	Year ended 31/03/2023	Quarter ended 30/09/2023	Quarter ended 30/09/2022	Year ended 31/03/2023
Total income from operations (net)	60.00	60.00	240.56	420.56	423.13	1777.47
Net Profit/(Loss) (before Extraordinary activities after tax)	(22.35)	(68.44)	(161.01)	(79.14)	(88.64)	(186.11)
Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)	(22.35)	(68.44)	(161.01)	(79.14)	(88.64)	(186.11)
Equity Share Capital	600.99	600.99	600.99	600.99	600.99	600.99
Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.37)	(1.16)	(2.68)	(1.32)	(1.47)	(3.10)
Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each Basic: Diluted:	(0.37)	(1.16)	(2.68)	(1.32)	(1.47)	(3.10)

Note:

The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Unaudited Quarterly Financial Results are available on the Stock Exchange websites. (URL: <http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=519494&dur=A&expandable=0>)

For and on behalf of Board of Directors
N. K. Industries Limited

Date: 9th November, 2023
Place: Ahmedabad

Sd/-
Mr. Hasmukhbhai K Patel
Din: 06587284 (Whole Time Director)

PRE OFFER ADVERTISEMENT IN ACCORDANCE WITH REGULATION 18(7) OF SEBI (SUBSTANTIAL ACQUISITION OF SHARES AND TAKEOVER) REGULATIONS, 2011, AS AMENDED AND CORRIGENDUM TO THE DETAILED PUBLIC ANNOUNCEMENT WITH RESPECT TO THE OPEN OFFER TO THE SHAREHOLDERS OF

CONTAINERWAY INTERNATIONAL LIMITED

CIN: L60210WB1985PLC038478

Regd. Office: 6th Floor, Room No 608, Saltee Plaza Cabin No M-11, Near ILS Hospital, Kolkata, Mall Road, Kolkata, West Bengal, India, 700080
Tel No.: 011-26033925 | Website: www.containerway.co.in | E Mail: containerwayinternational@gmail.com

Open offer for acquisition of up to 16,99,672 (Sixteen Lakh Ninety Nine Thousand Six Hundred Seventy Two) fully paid-up equity shares of face value of ₹ 5.00 each ("Equity Shares"), representing 26.00% of the voting share capital of Containerway International Limited ("Target Company") from the public shareholders of the Target Company by Mr. Sanket Deora, (Acquirer No. 1) and Mr. Sanjay Deora (Acquirer No. 2) and Mr. Surendra Shah, (PAC) at an offer price of ₹ 6.00/- (Rupees Six Only), with an intention to acquire control over the Target Company, pursuant to and in compliance with Regulations 3(2) and applicable provisions of the Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, and subsequent amendments thereof (the "SEBI (SAST) Regulations") (the "Open Offer" or "Offer").

This advertisement ("Offer Opening Public Announcement") in accordance with Regulation 18(7) of the SEBI (SAST) Regulations and Corrigendum to Detailed Public Statement is being issued by Interactive Financial Services Limited ("The Manager to the Offer") on behalf of Mr. Sanket Deora, (Acquirer No. 1), Mr. Sanjay Deora (Acquirer No. 2) and Mr. Surendra Shah, (PAC) in respect of the open offer to the Equity Shareholders of Containerway International Limited (hereinafter referred as the "Target Company"). This Pre Offer Advertisement cum Corrigendum should be read in conjunction with the (a) Public Announcement Dated August 7, 2023 ("PA"); (b) Detailed Public Statement ("DPS") which was published in all editions of Financial Express (English and Gujarati), Jansatta (Hindi), Pratahak (Marathi) (Maharashtra edition) and Arthik Lipi (Bengali) (Calcutta Edition) On August 14, 2023; (c) Draft Letter of Offer dated August 23, 2023 (DLOF); (d) Letter of Offer along with Form of Acceptance-Cum-Acknowledgement dated November 02, 2023 (LOF).

This Advertisement cum Corrigendum is being published in all newspaper in which the DPS was published.

The capitalised terms used in this Pre- Offer Advertisement cum Corrigendum have the meaning assigned to them in the LOF, unless otherwise specified.

- The Offer Price is being ₹ 6.00/- (Rupees Six Only) per Equity share of the Target Company, payable in cash in accordance with Regulation 9(1) of SEBI (SAST) Regulations. There has been no revision in the Offer Price.
- The Committee of the Independent Directors of the Target Company ("IDC") published its recommendations on the Offer on November 08, 2023 in the same newspapers where the DPS was published. Based on the review, IDC Members believe that the Offer is fair and reasonable in line with the SEBI (SAST) Regulations, 2011.
- The offer is not a competing offer in terms of the Regulation 20 of SEBI (SAST) Regulations, 2011. There was no competing offer to the Offer and the last date for making such competing offer has expired. The offer is not conditional upon any minimum level of acceptance in terms of Regulation 19(1) of SEBI (SAST) Regulations, 2011.
- The dispatch of the Letter of Offer to all the Public Shareholders of the Target Company holding Equity Share on the Identified Date i.e. Friday, November 01, 2023 has been completed through Speed post and registered post on November 06, 2023 and E-mail on November 04, 2023. The Identified Date was relevant only for the purpose of determining the Public Shareholders as on such date to whom the Letter of Offer was to be sent. It is clarified that all the Holders (registered or unregistered) of Equity Shares (except the Acquirers, PAC and Promoters) are eligible to participate in the Offer any time during the Tendering Period.
- Please note that a copy of Letter of Offer (including Form of Acceptance cum acknowledgement along with Form SH-4 Securities Transfer Form) is also available on website of SEBI at (www.sebi.gov.in). Registered/unregistered shareholders if they may also apply on the form of acceptance download from the SEBI website. Further in case of non-acceptance/non-availability of the Form of Acceptance cum acknowledgement, the application can be made on plain paper along with the following details and to be sent to Registrar to the Offer. Name, address, number of Equity Shares held, client ID number, DP name, DP ID number, number of Equity Shares tendered and other relevant documents as mentioned in Point 8.1.15 and 8.1.16 of the LOF.

The Procedure for tendering Equity Shares in the Offer are as below:

a) In case the shares are held in physical form:

Public Shareholders holding Equity Shares in physical form may participate in the Open Offer through their respective Selling Broker by providing the relevant information and documents as mentioned in paragraph 8.1.16 (page 27) of the LOF.

b) In case the shares are held in demat form

Public Shareholders who desire to tender their Equity Shares in the electronic / dematerialized form under the Offer would have to do so through their respective Selling Brokers by giving the details of Equity Shares they intend to tender under the Offer and as per the procedure specified in paragraph 8.1.15 (page 26) of the LOF.

Public Shareholders can send/deliver the Form of Acceptance cum acknowledgement duly signed along with all the relevant documents at registered office of the Registrar (Beetal Financial & Computer Services Private Limited) at 99, Madangir, B/4, Local Shopping Centre, Near Dada Harsukh Das Mandir New Delhi D1 110062 India, during the working hours on or before the date of closure of the Tendering period in accordance with the procedure as set out in Letter of Offer. For further details, the Public Shareholders are requested to refer to Part B titled "Procedure for Acceptance and Settlement" on page 25 of the LOF.

6. In accordance with Regulation 16(1) of the SEBI (SAST) Regulations, 2011 the draft Letter of Offer was filed to SEBI on August 23, 2023. The Final Observations received from SEBI dated October 30, 2023 bearing reference No SEBI/HO/CFD/RAC/DCR-2/P/O/W/43843/2023 in terms of Regulation 16(4) of the SEBI (SAST) Regulation.

7. Material updates since the date of the Public Announcement:

- There are no material updates in relation to this open offer since the date of Public Announcement
- As on the date of the Letter of Offer, to the best of the knowledge and belief of the Acquirers and PAC, there are no statutory or other approvals required to acquire the Equity Shares by the Acquirers along with the PAC validly tendered pursuant to this Open Offer. However, in case of any statutory approvals are required or become applicable prior to completion of the Offer, the Offer would be subject to the receipt of such statutory approvals.

8. Revised Schedule of Activity is as follow:

Activity	Tentative Schedule		Revised Schedule	
	Day	Date	Day	Date
Date of Public Announcement	Monday	August 7, 2023	Monday	August 7, 2023
Date of publishing of Detailed Public Statement	Monday	August 14, 2023	Monday	August 14, 2023
Last date of filing Draft Letter of Offer with SEBI	Wednesday	August 23, 2023	Wednesday	August 23, 2023
Last date for public announcement for competing offer(s)	Wednesday	September 6, 2023	Wednesday	September 6, 2023
Last date for receipt of comments from SEBI on the Draft Letter of Offer (in the event SEBI has not sought clarifications or additional information from the Manager)	Wednesday	September 13, 2023	Monday	October 30, 2023
Identified Date	Friday	September 15, 2023	Wednesday	November 01, 2023
Date by which Letter of Offer to be dispatched to the Shareholders	Monday	September 25, 2023	Wednesday	November 08, 2023
Last date for upward revision of the Offer Price and/or the Offer Size	Friday	September 29, 2023	Wednesday	November 15, 2023
Last date by which the committee of Independent Directors of the Target Company shall give its recommendations	Friday	September 29, 2023	Monday	November 13, 2023
Advertisement of schedule of activities for Open Offer, status of statutory and other approvals in newspapers and sending to SEBI, Stock Exchanges and Target Company at its registered office	Tuesday	October 3, 2023	Wednesday	November 15, 2023
Date of Commencement of Tendering Period (Offer Opening Date)	Wednesday	October 4, 2023	Thursday	November 16, 2023
Date of Expiration of Tendering Period (Offer Closing Date)	Tuesday	October 17, 2023	Thursday	November 30, 2023
Last date of communicating of rejection / acceptance and payment of consideration for accepted tenders / return of unaccepted shares	Wednesday	November 1, 2023	Thursday	December 14, 2023
Issue of post offer advertisement	Wednesday	October 25, 2023	Thursday	December 07, 2023
Last date for filing of final report with SEBI	Wednesday	November 8, 2023	Thursday	December 21, 2023

10. Other Information:

- The Acquirers and PAC accept full responsibility for the information contained in this Pre Offer Advertisement cum Corrigendum and also for the fulfillment of their obligations laid down in the SEBI (SAST) Regulations.
- A copy of this Offer Opening Public Announcement cum Corrigendum shall also be available on the SEBI website at www.sebi.gov.in.

ISSUED BY THE MANAGER TO THE OFFER:

INTERACTIVE FINANCIAL SERVICES LIMITED
Address: 508, Fifth Floor, Priviera, Nehru Nagar, Manekbag, Ahmedabad - 380015, Gujarat, India
Tel No.: +079 35217439 | (M) : +91-9898055647 | Web Site: www.ifnservices.in | Email : mdb@ifnservices.in
Contact Person: Ms. Jaini Jain | SEBI Reg No: INM00012856

FOR AND ON BEHALF OF ACQUIRERS AND THE PAC: Mr. Sanket Deora, (Acquirer No. 1), Mr. Sanjay Deora (Acquirer No. 2) and Mr. Surendra Shah (PAC)

Place: Ahmedabad Date: November 10, 2023

Oriental Aromatics Ltd.

Regd. Office: 133, Jehangir Building, 2nd Floor, M.G. Road, Mumbai - 400 001.
CIN : L17299MH1972PLC285731
Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2023.

₹ In Lakh (Except per share data)

Sr.No	Particulars	Standalone			Consolidated		
		Quarter Ended	Half Year Ended	Quarter Ended	Quarter Ended	Half Year Ended	Quarter Ended
		30.09.2023	30.09.2023	30.09.2022	30.09.2023	30.09.2023	30.09.2022
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
1.	Total Income from Operations (Net)	22,963.50	42,590.52	22,310.75	22,963.50	42,590.52	22,310.75
2.	Net Profit for the period (before tax)	349.61	(429.03)	897.85	342.23	(449.38)	879.18
3.	Net Profit for the period (after tax)	250.42	(343.03)	649.60	242.48	(362.16)	633.82
4.	Total Comprehensive Income for the period	248.92	(346.03)	641.60	240.98	(365.16)	625.82
5.	Paid-up Equity Share Capital (FV of Rs.5/- each)	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1,682.68	1,682.68
6.	Earnings per Share (EPS)						
	- Basic & Diluted EPS	0.74	(1.02)	1.93	0.72	(1.08)	1.88

Notes: 1) The above Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on November 09, 2023. The statutory auditors of the Company have reviewed the financial results for the quarter and half year ended Sept 30, 2023 in terms of Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and have issued their review reports with unmodified conclusion on the unaudited Consolidated and Standalone Financial Results. 2) The full format of above extract of Financial Results, together with the Report of the Statutory Auditors are available on website of the Stock Exchanges viz. www.bseindia.com & www.nseindia.com and also under "Investor Relations" link of Company's website www.orientalaromatics.com

Place : Mumbai
Date : 09/11/2023

For Oriental Aromatics Ltd.
Sd/-
Dharmil A. Bodani
Chairman & Managing Director
DIN : 00618333

એચઆરએમ શાખા, સાતમો માળ, ગીફ્ટ વન બિલ્ડિંગ, ગીફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫

કેનરા બેંક Canara Bank
સિલિક્ટ સિન્ડિકેટ

ઈ-હરાજીની વેચાણ નોટીસ સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠળ જાહેર નોટીસ

તારીખ : ૧૫.૧૨.૨૦૨૩ ના રોજ મેગા ઈ-હરાજીની વિગતો (બપોરે ૦૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક સુધી)
ઈ.એમ.ડી.ની છેલ્લી તારીખ : ૧૪.૧૨.૨૦૨૩

જાહેર જનતા તથા દેવાદારો-જમીનદારો-ગીરવેદારોને આથી જાણ કરવાનો કે નાણાકીય મિલકતોની જામીનગીરી અને વ્યાજના પુનઃ લાગુ પડવા માટેનો કાયદો, ૨૦૦૨ (સરફેસી એક્ટ-૨૦૦૨) હેઠળ નિયમ ૧૩(૪) હેઠળ નોંધેલી મિલકત-મિલકતોની વેચાણ અર્થે ઈ-ઓક્શન એરેલે કે ઈ-હરાજી, કેનરા બેંકને લેવાની યાદ લેવાની ભરપૂર્ણ માટે સિલ્કોરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્પોરેટેડ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૯ (૧) હેઠળ જ્યાં છે, જેમ છે, તેવી સ્થિતિમાં વેચાણ કરવાની છે એ માટે સિલ્કોરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્પોરેટેડ) એટલે કે જામીનગીરી વ્યાજ (લાગુ પાડેલ) ૨૦૦૨ કાયદા હેઠળ દર્શાવેલ શરતો અને નિયમો મુજબ તથા નીચેની વધારાના શરતો મુજબ વેચાણ કરવામાં આવશે.

ક્ર. નં.	દેવાદારો / જમીનદારો / ગીરવેદારોના નામ	બાકી રકમ (₹.)	મિલકતની વિગતો / કબજાનો પ્રકાર	રીઝર્વ ફિંકમ/ ઈએમડી (₹.)	ખાતાની માહિતી અને નામ, શાખાની સંપર્ક વિગતો
1	મેસર્સ મુખ્ય વિનાઇલ પ્રા. લિ., શ્રી ઇન્ટરિયર્સ જે. પટેલ, શ્રીમતી કામીનીબેન જી. પટેલ, શ્રી જયંતિભાઈ જે. પટેલ, શ્રીમતી દામીનીબેન જે. પટેલ, શ્રી મનોજકુમાર જે. પટેલ, કુ. સુભાષીબેન પટેલ, અને મેસર્સ સ્નેહદાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિમિટેડ. (અગાઉ ડિગિટાલ નેસ્ટી ઈન્ફ્રા પ્રા. લિ. તરીકે જાણીતી) (જમીનદાર / ગીરવેદાર)	₹. ૨૨,૬૭,૩૨,૨૨૧.૦૬ તા. ૧૮.૦૧.૨૦૨૨ મુજબ વાત તેની પરના શાગળના વ્યાજ અને અન્ય ચાર્જિસ + બેંક ઓફ ઈન્ડિયાની બાકી રકમ ₹. ૫૪,૭૪,૦૪,૫૯૭.૬૦ આખી વારીમ મુજબ વાત તેની પરના શાગળના વ્યાજ અને અન્ય ચાર્જિસ	મે. સ્નેહદાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. (અગાઉ મે. ડિગિટાલ નેસ્ટી ઈન્ફ્રા પ્રા. લિ. તરીકે જાણીતી) ના નામે સુરેન્દ્રશંકર જી. જી. અમદાવાદ-૪ (પાલડી) માં ગામ કોચરન, લો ગાંડન, એલિયાલિય, અમદાવાદ, ટી.પી.નં. ૩/૬, કાશ્મીર પોલ નં. ૬૦૩ ધરવાલી બીજા ખેતીલાયક જમીન પર વિકસીત હાઈ સ્ટ્રીટ-૧ તરીકે જાણીતી સ્કીમમાં ૩૫.૦૫% એટલે કે ૧૦૨૪ ચો.ફીટ સુધી સુરેન્દ્રશંકર ઈન્ફ્રા પ્રા. લિ. (અગાઉ ડિગિટાલ નેસ્ટી ઈન્ફ્રા પ્રા. લિ. તરીકે જાણીતી) માં ગામ કોચરન પર વિકસીત આદા બજાર તરીકે જાણીતી સ્કીમમાં સ્કીમનો કોમન સુવિધાઓની સાથે જમીનના અભિવ્યક્ત હિસ્સા સહિત આઈન્ડ ક્લોર ઉપર કુલ આશરે ૧૬,૬૦.૮૧ ચો.ફીટ એટલે કે ૧૫૬.૦૩ ચો.મી.માળના યુનિટ નં. ૩/૬-૨૮ અને પહેલા માળે કુલ આશરે ૨૦૦૦ ચો.ફીટ એટલે કે ૧૮૫.૮૦ ચો.મી. (સુરેન્દ્રશંકર ઈન્ફ્રા પ્રા. લિ. તરીકે જાણીતી) માળના એન્કોર્પોરેટેડ/એટલે કે તરીકેની સ્થાવર મિલકતના તે તમામ પીસ અને પાર્સલ.	રીઝર્વ ફિંકમ : ₹. ૧,૪૨,૦૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦	
2	શ્રી જુગલ કિશોર હાજીભાઈ ગાયર, શ્રીમતી સરીતા દેવી જુગલ કિશોર ગાયર, શ્રી નારાયણ પ્રસાદ ગાયર, શ્રીમતી ભવની દેવી ગાયર (અગાઉ એ. સુખિમ ઈન્ડિયા ઈન્ફ્રા પ્રા. લિ. ના કાયરેક્ટરો અને જમીનદારો)	કેનરા બેંકના નોટીસમાં સભ્ય બેંકો - બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈસ્ટી (ઈ-સ્ટી) અને બેન્ક-વિજયા બેંક) અને સુકો બેંકના - બેંકોના કોઓર્ડિનેશન બાકી નીકળતા નામદાર ઈઆરટી-૨ અમદાવાદ સમક્ષ ફાઇલ કરાયેલ મૂળ અરજી નં. ૩૫૦/૨૦૧૯ માં દર્શાવેલ હુકમનામાના લેણા - તા. ૦૩.૧૨.૨૦૧૯ મુજબ ₹. ૨,૬૪,૦૦,૩૩,૧૨૪. ૫૦ વાત સુકોમાં દર્શાવેલ આગળનું વ્યાજ અને તેની પરના અન્ય ચાર્જિસ	તાલુકા: ચોયાંચી, જિલ્લા: સુરતના સલાતનપુરા વિસ્તારમાં સ્થિત સિટી સર્વે વોર્ડ નં. ૩, નોંધ નં. ૨૧૫૭/૨/૧, ૨૧૫૭/૨/૧ અને ૨૧૫૭/૨/૨/એ ધરવાલી જમીન ઉપર બંધાયેલ કમિટી બિલ્ડિંગની જમીનમાં (મલ્કેટ હુકમનામા) ૩.૬૬ ચો.મી. માળના પ્રમાણસર અભિવ્યક્ત હિસ્સા સહિત કોહિનુર ડેસ્ટાઈલ માર્કેટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. ની કોહિનુર ડેસ્ટાઈલ માર્કેટના લોઅર આઈન્ડ ક્લોર ઉપરની સ્થાવર મિલકતના તે તમામ પીસ અને પાર્સલ.	રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦ રીઝર્વ ફિંકમ : ₹. ૧૪,૨૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૧,૪૨,૦૦૦.૦૦	એચઆરએમ શાખા ફોન નં. 079 - 69027812 / 818 / 823 / 820 / 822 મો. : 8238091942 / 9033119700 / 8470037686 ઈ-મેલ : cb3966@canarabank.com A/C No.: 209272434 IFSC : CNRB0003966
3	મે. દિવા ટ્રેડ સિલ્કસ (દેવાદાર / ગીરવેદાર), (૧) શ્રી કોશિકે કે શાહ, (૨) શ્રી નવવેભાઈ જે સાલિયા, (૩) શ્રી ધર્મસ બી તંગોલી, (૪) શ્રી કિરીટભાઈ એ શાહ, (૫) શ્રીમતી રશ્મિબેન તંગોલી.	₹. ૬૧,૬૦,૬૧૧.૪૧ તા. ૩૧.૧૦.૨૦૨૩ મુજબ વાત આગાઉનું વ્યાજ અને ચાર્જિસ વગેરે.	વોટ નં ૧૪ પેકી દિશા બાજુ પર આઈન્ડ અને પ્રથમ બાંધકામ, બિલ્ડિંગ જાણીતી નિર્મિત આવેલ છે કેમપાલી, દિમિલીઆડ, સુરત, ધારક સિટી સર્વ વોર્ડ નં. ૧, નોંધ નં ૧૪૦૩/એ/બી/ડી, ટી.પી.સ્કીમ નં.૨.(નાનપુરા) ઈશ્વર પાલેટનં. ૩૦ અને ૨૮/જે સિટી સુરત, તાલુકો સુરત, કુલ આશરે ૧૬૬.૩૮૮ ચો.મી.તે ઉપર બાંધકામ લગભગ ૧૧૧.૬૧ ચો.મી.પેકી ૬૮.૮૦ ચો.મી.ચતુ:કોના - પૂર્વ-વોટ નં ૨૦, પશ્ચિમ-રોડ, ઉત્તર- વોટ નં ૧૪પેકી, દિશા-વોટ નં.૧૫ પછી માર્ગનું.	રીઝર્વ ફિંકમ : ₹. ૬૪,૦૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૬,૪૦,૦૦૦.૦૦	
વિશેષ નોંધ : પ્રાધાન્ય તે વ્યક્તિ/ઓ ને આપવામાં આવશે જે તમામ ૧૬ હુકમો માટે એકીસાથે એકિફ્ટ બિડ કરશે. ખરીદનારાઓને મિલકતોના કાગળોની પ્રમાણિત નકલ પણ આપવામાં આવશે.			રીઝર્વ ફિંકમ : ₹. ૨૫,૦૦,૦૦૦.૦૦ ઈએમડી : ₹. ૨,૫૦,૦૦૦.૦૦		

MAX HEIGHTS INFRASTRUCTURE LIMITEDSD-65, Tower Apartment, Pitampura, New Delhi-110034, Tel: +91-11- 2731 4646
CIN: L67120DL1981PLC179487 Website: www.maxheights.com; Email: maxinfra1981@gmail.com

EXTRACT OF CONSOLIDATED & STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023

Sl. No.	Particulars	Consolidated					Standalone				
		For Quarter ended		For Half Year Ended		For the Year ended	For Quarter ended		For Half Year Ended		For the Year ended
		30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)
1	Total Income from Operations	1008.22	171.76	1402.66	327.99	718.41	1008.22	171.76	1402.66	328.00	603.98
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	65.20	(0.18)	(8.38)	28.46	(178.73)	65.71	(0.08)	(3.85)	29.08	23.78
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	65.20	(0.18)	(8.38)	28.46	(178.73)	65.71	(0.08)	(3.85)	29.08	23.78
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	65.20	(0.18)	(8.38)	28.46	(181.57)	65.71	(0.08)	(3.85)	29.08	20.91
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	0.00	0.00	0.00	0.00	0.00	65.71	(0.08)	(3.85)	29.08	20.91
6	Equity Share Capital	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92	1,560.92
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.00	0.00	0.00	0.00	1,708.94	-	-	-	-	1,708.94
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)										
	1. Basic	0.42	-	-	0.19	0.13	0.42	-	-	0.19	0.13
	2. Diluted	0.42	-	-	0.19	0.13	0.42	-	-	0.19	0.13

NOTES:

- The above is an extract of the detailed format of Consolidated & Standalone Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Consolidated & Standalone Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2023 are available on the websites of the Stock Exchange viz. www.bseindia.com and the Company's website viz. www.maxheights.com.
- The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the meeting held on Thursday, 9th November, 2023 and subjected to Limited Review by Statutory Auditors, pursuant to Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended.
- The figures of the previous period/year have been regrouped/reclassified, wherever considered necessary, to conform to current year's classification.
- The Company operates in three segments i.e. Real Estate, Financing and Shares within one geographical region i.e. India.
- The Limited review as required under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 has been completed and Related Report does not have any impact on above Results and Notes for the Quarter and Half Year ended 30th September, 2023 which needs to be explained and the Auditors have expressed their unqualified opinion.

For MAX HEIGHTS INFRASTRUCTURE LIMITED

Sd/-

Sonali Mathur

Company Secretary and Compliance Officer

M. No. - A82265

Place: New Delhi

Date: 09.11.2023

SHYAM CENTURY FERROUS LIMITED

CIN: L27310ML2011PLC008578

Regd. Office : Vill.: Lumshnong, PO: Khaliehriat,

Dist. East Jaintia Hills, Meghalaya - 793210, Phone: 0365-278215, Fax: 0365-278217

Email: investors@shyamcenturyferrous.com; website: www.shyamcenturyferrous.com

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended 30th September, 2023

(₹ in Lacs)

Particulars	Quarter ended			Half Year ended			Year ended
	30.09.2023 (Unaudited)	30.06.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2023 (Unaudited)	30.09.2022 (Unaudited)	31.03.2023 (Audited)	
Total Income from Operations	2,911.41	4,101.84	4,543.01	7,013.25	7,932.86	18,819.23	
Net Profit/(Loss) for the period (before tax, after exceptional items and or extraordinary items)	(109.77)	300.21	872.27	190.44	1,819.55	3,666.41	
Net Profit/(Loss) for the period (after tax, exceptional items and or extraordinary items)	(87.09)	210.03	648.76	122.94	1,355.01	2,663.77	
Total Comprehensive Income for the period (comprising profit/(loss) for the period after tax and other comprehensive income after tax)	(90.35)	209.81	646.77	119.46	1,353.44	2,662.86	
Paid up Equity Share Capital (Face Value of ₹ 1/- each)	2,121.73	2,121.73	2,221.73	2,121.73	2,221.73	2,121.73	
Earnings Per Share (of ₹ 1/- each)							
-Basic & Diluted (Not annualised) (₹)	(0.04)	0.10	0.29	0.06	0.61	1.26	

NOTES TO FINANCIAL RESULTS:

- The above is an extract of the detailed format of unaudited Financial results for the Quarter and half year ended 30th, September 2023 which were reviewed by the Audit Committee and approved at the meeting of the Board of Directors held on 9th November, 2023. It has been filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of the Financial result are available on the Stock Exchange websites - www.nseindia.com and www.bseindia.com and also on the Company's website www.shyamcenturyferrous.com.
- The Company is primarily engaged in the manufacture and sale of ferro silicon. There are no separate reportable segments as per Ind AS 108, "Operating Segments".
- Figures of the previous period/year have been regrouped and reclassified to conform to the classification of current period, wherever necessary.

By order of the Board

For Shyam Century Ferrous Limited

Sd/-

Aditya Vimalkumar Agrawal

Managing Director

Date: 09th November, 2023

Place: Kolkata

Welspun ENTERPRISES

WELSPUN ENTERPRISES LIMITED

CIN: L45201GJ1994PLC023920

Regd. Office : Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat - 370110.

Corp. Office : Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013.

Website: www.welspunenterprises.com Email Id : companysecretary_wel@welspun.com

Extract of Statement of Unaudited Consolidated Financial Results for the quarter and half year ended 30 September 2023

Sr. No.	PARTICULARS	Quarter ended			Period ended			Year ended
		30 Sept, 2023	30 June, 2023	30 Sept, 2022	30 Sept, 2023	30 Sept, 2022	31 March, 2023	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total Income	692.65	750.04	552.92	1,442.69	1,268.41	2,901.64	
2	Net Profit for the period from continuing operations (before tax and exceptional items)	96.94	126.50	39.93	223.44	73.43	258.44	
3	Exceptional items (net)	-	-	66.68	-	66.68	482.99	
4	Net Profit for the period from continuing operations before tax (after exceptional items)	96.94	126.50	106.61	223.44	140.10	741.43	
5	Net Profit for the period from continuing operations after tax (after exceptional items and excluding non-controlling interests)	65.11	92.58	100.38	157.69	124.80	681.12	
6	Net Profit for the period from discontinuing operations after tax (after exceptional items and excluding non-controlling interests)	(3.08)	(0.80)	31.76	(3.88)	55.75	41.64	
7	Net Profit for the period from continuing and discontinuing operations after tax and after exceptional items and excluding non-controlling interests	62.03	91.78	132.14	153.81	180.55	722.76	
8	Total Comprehensive Income for the period from continuing and discontinuing operations (Comprising profit for the period (after tax) and Other Comprehensive Income (after tax) and excluding non-controlling interests)	65.22	91.53	130.89	156.75	179.65	719.63	
9	Paid-up equity share capital (Face Value Rs. 10/- each)	136.41	136.38	149.98	136.41	149.98	149.98	
10	Reserves (excluding Revaluation Reserve)						2,206.03	
11	Earnings per share (EPS) from continuing operations							
	* Not Annualised							
	(a) Basic EPS (Rs)	4.78 *	6.65 *	6.70 *	11.43 *	8.32 *	45.42	
	(b) Diluted EPS (Rs)	4.69 *	6.60 *	6.68 *	11.29 *	8.30 *	45.31	
15	Earnings per share (EPS) for continuing and discontinuing operations							
	* Not Annualised							
	(a) Basic EPS	4.56 *	6.59 *	8.82 *	11.15 *	12.04 *	48.19	
	(b) Diluted EPS	4.47 *	6.55 *	8.79 *	11.01 *	12.01 *	48.08	

Notes :-

- The above is an extract of detailed format of quarterly and half year ended financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly and half year ended financial results are available on the Stock Exchanges website www.nseindia.com and www.bseindia.com and also on company's website www.welspunenterprises.com
- Additional information on standalone financial results is as follows :-

Sr. No.	PARTICULARS	Quarter ended			Period ended			Year ended
		30 Sept, 2023	30 June, 2023	30 Sept, 2022	30 Sept, 2023	30 Sept, 2022	31 March, 2023	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total Income	571.05	709.45	520.37	1,280.50	1,211.21	2,775.01	
2	Net profit for the period (before tax and exceptional items)	76.86	120.04	37.80	196.90	69.44	250.16	
3	Net profit for the period before tax (after exceptional items)	76.86	120.04	43.07	196.90	74.71	760.08	
4	Net profit for the period after tax	53.77	89.64	39.61	143.41	64.58	713.12	
5	Total Comprehensive Income for the period (after tax)	56.96	89.39	38.36	146.35	63.68	710.06	

For Welspun Enterprises Limited

Sd/-

Sandeep Garg

Managing Director

DIN: 00036419

Place: Mumbai

Date: 9th November, 2023

MANAPPURAM

HOME FINANCE LTD.

Regd. Office: 5th Floor, W - 4/ 638A, Manappuram House, P.O. Valapad, Thrissur - 680 567, Kerala, India
CIN : U65923KL2010PLC039179

Statement of Unaudited Financial Results for the quarter & half year ended September 30 2023

(Regulation 52(8), read with Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015)

(Amount Rs.in Lakhs)

Sl. No.	Particulars	For the quarter ended	For the quarter ended	For the year ended
		September 30 2023	September 30 2022	31 March 2023
		(Un-audited)	(Un-audited)	(Audited)
1	Total Income from Operations	5,745.99	3,707.94	16,574.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	588.73	619.24	2,591.70
3	"Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)"	588.73	619.24	2,591.70
4	"Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)"	446.79	418.34	1,946.87
5	"Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]"	443.52	412.66	1,947.27
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- per share)	20,000.00	20,000.00	20,000.00
7	Reserves (excluding Revaluation Reserves)	4,415.87	2,832.44	3,644.59
8	Securities Premium Account	-	-	-
9	Net Worth	24,415.87	22,832.44	23,644.59
10	Paid up Debt Capital/Outstanding Debt	-	-	-
11	Outstanding Redeemable Preference Shares	-	-	-
12	Debt Equity Ratio	4.56	3.17	4.00
13	Earnings per Share (Face Value of Rs. 10 each)(For continuing and discontinuing operations)			
	- Basic	0.22	0.21	0.97
	- Diluted	0.22	0.21	0.97
14	Capital Redemption Reserve	-	-	-
15	Debt Redemption Reserve	-	-	-
16	Debt Service Coverage Ratio	-	-	-
17	Interest Service Coverage Ratio	-	-	-

- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

Note:

- The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly financial results are available on the websites of the Stock Exchange(s) (www.bseindia.com) and the listed entity (www.manappuramhomefin.com).
- For the items referred the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange(s) (BSE Limited) and can be accessed on the URL (www.bseindia.com).

For and on behalf of the Board of Directors

V.P.Nandakumar

Chairman

(DIN No: 00044512)

Place: Valapad

Date: 08-11-2023

N. K. Industries Limited

Registered Office: 7th Floor, Popular House, Ashram Road Ahmedabad - 380 009.

Work: T-5, Kadi-Thor road, Kadi - 382 715 Dist. - Mehsana (North Gujarat)

E-mail: nkil@nkiproducts.com, Web: www.nkindustriesltd.com

CIN: L9110GJ1981PLC009905, Pa. - 41-19-4630 9999

Extracts of unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended on 30th September, 2023

(Rs. In lacs)

Particulars	Standalone			Consolidated		
	Quarter ended 30/09/2023	Quarter ended 30/09/2022	Year ended 31/03/2023	Quarter ended 30/09/2023	Quarter ended 30/09/2022	Year ended 31/03/2023
Total income from operations (net)	60.00	60.00	240.56	420.56	423.13	1777.47
Net Profit/(Loss) (before Extraordinary activities after tax)	(22.35)	(68.44)	(161.01)	(79.14)	(88.64)	(186.11)
Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)	(22.35)	(68.44)	(161.01)	(79.14)	(88.64)	(186.11)
Equity Share Capital	600.99	600.99	600.99	600.99	600.99	600.99
Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each	(0.37)	(1.16)	(2.68)	(1.32)	(1.47)	(3.10)
Diluted:						
Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each	(0.37)	(1.16)	(2.68)	(1.32)	(1.47)	(3.10)
Diluted:						

Note:

- The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Unaudited Quarterly Financial results are available on the Stock Exchange websites. (URL: <http://www.bseindia.com/corporates/ann.aspx?scip=51944&dur=A&expandable=0>)

For and on behalf of Board of Directors

N. K. Industries Limited

Sd/-

Mr. Hasmukhbhai K Patel

Din: 06587284 (Whole Time Director)

Date: 9th November, 2023

Place: Ahmedabad